

સ્થાપના વર્ષ - ૧૯૪૦
કપડવાણ કેળવણી મંડળનું
મુખપત્ર
(ફક્ત અંગત વિતરણ હેતુ)

વર્ષ:૧ અંક:૧૨ માસ: ઓક્ટોબર, ૨૦૧૯

||પૃષ્ઠ:૧||

શ્રી.એમ.વી.પરીખ ઈ.મી.સ્કૂલ (નર્સરી)

લાયબ્રેરીની નવી પહેલ

બાળકોમાં નાનપણથી જ વાંચન પ્રત્યે રુચિ વધે અને તે તરફ પ્રેરાય તે હેતુથી શ્રી.એમ.વી.પરીખ ઈ.મી.સ્કૂલ માં library સેટ કરવામાં આવી. જેમાં શિક્ષકો તથા બાળકો સાથે બેસી વાંચન કરે એવું આયોજન કરાયું. આ પ્રક્રિયા મહિનામાં બે વખત કરવામાં આવશે. તથા બાળકોને લેવા આવનાર વાલી કે અન્ય વ્યક્તિ સમય મળે ત્યારે વાંચન કરી શકે તે હેતુથી શાળાના રિશેપ્સન હોલમાં Book Shelf તૈયાર કરવવામાં આવ્યું. આ નવા અભિગમને વાલીઓ ધ્વારા સહર્ષ આવકારવામાં આવ્યું.



શ્રી સ્પંદન બાલમંદિર નવરાત્રીની ઉજવણી



નવરાત્રી એટલે આસ્થા, ઉન્માદ અને ઉત્સાહનો પર્વ. નવરાત્રી શબ્દ સાંભળતા જ હૃદયમાં એક થનગનાટ અને ચહેરા પર આનંદ છવાઈ જાય. માતાની આરાધના અને ગરબાનો સમન્વય એટલે નવલા નોરતાં. તા:૦૫/૧૦/૧૯ના રોજ નાના-નાના ભૂલકાઓ સાથે શિક્ષકગણે ખુબજ આનંદ અને ઉમંગકાભેર નવરાત્રીની ઉજવણી કરી. સૌપ્રથમ માતાજીની આરતી કરી ત્યારબાદ રંગબેરંગી ચણિયાચોળી અને કેડિયું, ઝબ્ભો ધોતી પહેરીને આવેલ બાળકોએ ગરબાની રમઝટ બોલાવી. બાળકો અને શિક્ષકો સંગીતના સાથ અને ઢોલના નાદ સાથે ઝૂમી ઉઠ્યાં. ગરબાના સમાપન બાદ બાળકોને લહાણી રૂપે ડીશ આપવામાં આવી.

શ્રી એસ.સી.દાણી પ્રાયમરી સ્કૂલ

શાળાના વિદ્યાર્થીઓનો ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ દેખાવ



આ વર્ષે ખેલ મહાકુંભની અંદર તાલુકા કક્ષાએ ખો-ખો, કબડ્ડી, વોલીબોલ, રસ્સાખેંચ તથા એથલેટીક્સ જેવી વિવિધ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ શાળાનું નામ રોશન કર્યું. વિજેતા અનેલ ટીમ તથા ખેલાડીઓની વિગતો નીચે પ્રમાણે છે.

- ખો-ખો, વોલીબોલ તથા કબડ્ડી સ્પર્ધામાં ભાઈઓની ટીમ તાલુકા કક્ષાએ વિજેતા બની જિલ્લા કક્ષાએ રમવા જશે.
- ફૂટબોલ U-14 સ્પર્ધામાં ભાઈઓ તથા બહેનોની ટીમ જિલ્લા કક્ષાએ વિજેતા બની રાજ્ય કક્ષાએ રમવા જશે.
- ટેબલ ટેનિસમાં જિલ્લા કક્ષાએ પટેલ નીલ (પ્રથમસ્થાને), ખાંટ દિક્ષિત (તૃતીય સ્થાને), મકવાણા કિશ (ચોથા સ્થાને) તથા સોલંકી આયુષી (પાંચમા સ્થાને) વિજેતા બની રાજ્ય કક્ષાએ રમવા જશે. ટેબલ ટેનિસ ઓપન વિભાગમાં રિયા પટેલે બીજું સ્થાન મેળવેલ છે.
- બેડમિન્ટન સ્પર્ધામાં પરમાર દિપ મહેશભાઈ તૃતીય સ્થાન મેળવી રાજ્ય કક્ષાએ રમવા જશે.
- સ્કેટિંગ U-14 ભાઈઓની સ્પર્ધામાં શાહ વલયે 1000 મીટરમાં પ્રથમ અને 500 મીટરમાં દ્વિતીય સ્થાન મેળવેલ છે. U-14 બહેનોના વિભાગમાં પટેલ દેવાંશી એ 1000 મીટર અને 500 મીટર બંનેમાં પ્રથમ સ્થાન મેળવેલ છે. પટેલ પૃથાએ બંને વિભાગમાં દ્વિતીય અને U-11માં પટેલ વૃષ્ટિએ બંને વિભાગમાં દ્વિતીય સ્થાન મેળવેલ છે. આ તમામ વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાએ રમવા જશે.
- એથલેટિક્સમાં બહેનોના વિભાગમાં શેખ નાઝબાનુ U-14 ૪૦૦ મીટરમાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવેલ છે. અને ભાઈઓમાં મુસ્લિમખાન ૬૦૦ મીટર હડસલ માટે જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે.
- શિક્ષક વિભાગમાં પટેલ ઉર્વીશ જિલ્લા કક્ષાએ ગોળફેંક સ્પર્ધામાં પ્રથમ તથા મકવાણા મહેન્દ્ર ૧૦૦ મીટર દોડમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે.
- ઉપરોક્ત તમામ વિદ્યાર્થીઓને તથા તૈયાર કરનાર મકવાણા મહેન્દ્રકુમાર તથા પટેલ ઉર્વીશભાઈને શાળા પરિવાર વતી ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા તથા આવી સિદ્ધિઓ આગળ પણ પ્રાપ્ત કરતા રહે તે માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

શ્રી સી. એન. વિદ્યાલય



**“ઢબુકતા ઢોલના તાલે, ગરબાની હારે,
ઝૂમી ઉઢ્યા સહુ વહેલી સવારે.”**

હા, ઉપરોક્ત ઉક્તિના સંદર્ભે તા:૦૫/૧૦/૨૦૧૯, શનિવારની સવારે શ્રી સી. એન. વિદ્યાલય, કપડવંજમાં ગરબા મહોત્સવ ઉજવાયો હતો. શાળાના યુનિફોર્મમાં આવવા ટેવાયેલા વિદ્યાર્થીઓને જ્યારે પરંપરાગત પહેરવેશમાં સજ્જ થઈ ગરબે ધૂમતા નિહાળીને ત્યાં ઉભેલા સર્વેની આંખો રંગબેરંગી બની ગઈ હતી. શાળાના શિક્ષક મિત્રો પણ ગરબાના રંગમાં રંગાઈ ગયા હતાં. સવારે 8:00 થી લઈ 11:00 વાગ્યા સુધી વિદ્યાર્થીઓએ લગાતાર ગરબાની રમઝટ ઉડાડી હતી. ગરબાથી વિદ્યાર્થીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો જેની સાક્ષી પૂરતા કેટલાક દ્રશ્યો અહીં શેર કરું છું.



ગાંધી જયંતીની ઉજવણી

‘ગાંધીબાપુ અમર રહો’ના નારાની ગુંજ સાથે તા: ૦૨/૧૦/૧૯, બુધવારે ગાંધીજયંતિને દિવસે શ્રી સી.એન.વિદ્યાલયના આંગણેથી સ્વચ્છતા રાખવાની કટિબંધ પ્રતિજ્ઞા લઈ શાળાના વિદ્યાર્થીઓ અને શાળાના આચાર્યશ્રી અને સારસ્વત કર્મચારીઓએ એક મહા રેલી યોજી શાળા પ્રાંગણથી ગાંધીબાવલે ભારતના હીર, ખમીર, ધીર – ગંભીર એવા ગાંધી બાપુની મૂર્તિને ફૂલ હાર ચઢાવી, પૂજા અર્ચના કરી અંધારિયા વડે થઈ ટાઉનહોલ અને ત્યાંથી ફરી શાળાના આંગણે પાછા ફર્યા હતાં.